

ત્વરિત જાહેરાત માટે

## આગામી કાર્યક્રમોમાં બ્રેમ્પટનની વિવિધતા ઉજવવામાં આવશે

**અમારી સાથે તમિલ હેરિટેજ (વારસો) મહિનો, ચીની નૂતન વર્ષ, અને અશ્વેત લોકોનો ઇતિહાસ મહિનો ઉજવવા જોડાશો.**

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (જાન્યુઆરી 20, 2020) – મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown) અને કાઉન્સિલરો આ જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં શ્રેણીબદ્ધ આયોજનોમાં બ્રેમ્પટનની વિવિધતા ઉજવવા રહેવાસીઓને આમંત્રિત કરે છે. તમિલ હેરિટેજ (વારસો) વિશે વધુ જાણો, ચીની નૂતન વર્ષ ઉજવો, અને આપણાં સમુદાયમાં અશ્વેત કેનેડિયનોના ક્ષણને જાણો.

### તમિલ હેરિટેજ (વારસો) મહિનો

તમિલ કેનેડિયનોના ક્ષણને ઉજવવા જાન્યુઆરીને બ્રેમ્પટનમાં તમિલ હેરિટેજ મહિનો તરીકે ઓળખવામાં આવે છે. આ સમુદાયનો ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે વધુ માહિતી શુક્રવાર, જાન્યુઆરી 24 નાં રોજ સાંજે 7 થી રાત્રે 9 વાગ્યા વચ્ચે સીટી હોલ એટ્રિયમ (સ્વાગત કક્ષ)માં મેળવો. પરંપરાગત ભોજનનો સ્વાદ માણો, જીવંત પ્રસારણોનો આનંદ માણો, અને આ રોમાંચક આયોજનમાં તમિલ હેરિટેજ મહિનાનો ધ્વજરોપણ કરવામાં સમુદાય સાથે જોડાશો.

### ચીની નૂતન વર્ષ

શનિવાર, જાન્યુઆરી 26 નાં રોજ બપોરે 1 થી 4 વાગ્યા વચ્ચે સીટી હોલ એટ્રિયમમાં ચંદ્રના નૂતન વર્ષ અને ઉંદરના ચીની વર્ષને આવકારો. આ જીવંત ઉજવણીમાં આઈકોનિક ડ્રેગન અને સિંહ નૃત્યો, કેલિગ્રાફી (સુલેખન) કલાકારો અને ચા-નાસ્તો સામેલ રહેશે. સામુદાયિક આગેવાનો આગામી વર્ષ માટે સમૃદ્ધિ અને સારી તંદુરસ્તીની શુભેચ્છાઓ આપશે. આ કાર્યક્રમનું આયોજન બ્રેમ્પટન ચાઈનીઝ બિઝનેસ એસોસિએશન સાથેની ભાગીદારીમાં થઈ રહ્યું છે, અને તેને HSBC અને મેન્ડરિન રેસ્ટોરન્ટ દ્વારા ગૌરવવંતી સહાયતા મળી છે.

### અશ્વેત લોકોનો ઇતિહાસ મહિનો

ફેબ્રુઆરીને દેશભરમાં અશ્વેત લોકોનો ઇતિહાસ મહિનો તરીકે ઓળખ મળી છે, જે અશ્વેત કેનેડિયનોના વારસાને અને તેઓના અવિરત ક્ષણને સન્માન આપવાનો સમય છે. આપણાં શહેરના અશ્વેત અફ્રિકી અને કેરિબિયન સમુદાયોની ઉજવણીમાં ફેબ્રુઆરીમાં બે આયોજનોમાં હાજર રહેશો. મહિનાની શરૂઆત શનિવાર, ફેબ્રુઆરી 1 નાં રોજ બપોરે 2 વાગ્યે કેન વિલ્લન્સ સ્ક્વેરમાં ધ્વજરોહણ પ્રસંગ વડે કરો, અને મહિનાનું સમાપન શુક્રવાર, ફેબ્રુઆરી 28 નાં રોજ સીટી હોલમાં બીટ ઓફ બ્લેક હિસ્ટરી મન્થ વડે કરો. આ સમાપન કાર્યક્રમમાં કન્ઝર્વેટરીમાં બપોરે 12 થી રાત્રે 8 વાગ્યા સુધી ખાદ્ય અને છૂટક વિકેતાઓ સાથેનું બજાર રહેશે, અને એટ્રિયમમાં ગીત, નૃત્ય અને શબ્દ બોલી પ્રસ્તુતિઓ સહિતનું આયોજન રહેશે.

અશ્વેત લોકોનો ઇતિહાસ મહિનોમાં સહભાગી થવા ઈચ્છતા કલાકારો અને વિકેતાઓને ગુરુવાર, જાન્યુઆરી 30 સુધીમાં સીટીને અરજી કરવા આમંત્રિત કરવામાં આવે છે. [વિગતો માટે અમારી વેબસાઈટ જુઓ.](#)

આ આયોજનો બ્રેમ્પટનની વિવિધતાને સન્માન આપવા આપણાં શહેર દ્વારા આખા વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવતી શ્રેણીબદ્ધ ઉજવણીઓ પૈકી બ્રેમ્પટનના સામુદાયિક ઓળખ કાર્યક્રમનો એક ભાગ છે. રહેવાસીઓ માટે આ આયોજનો અન્ય સંસ્કૃતિઓ વિશે શીખવાની અને આપણાં શહેરનો ભાગ બનતા ઘણાં સમુદાયોને જાણવાની ચડિયાતી તક છે.

આ અને શહેરના અન્ય આયોજનો પર વધુ માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, [www.brampton.ca](http://www.brampton.ca).

### અવતરણ (ક્વોટ):

“બ્રેમ્પટન એક મોજેઈક છે અને સીટી કાઉન્સિલ આપણાં સમુદાયની અદ્ભુત વિવિધતા ઉજવવામાં ગૌરવ અનુભવે છે. કાઉન્સિલ વતી, અમે આશાવાદી છીએ કે તમામ સાંસ્કૃતિક પશ્ચાદભૂના રહેવાસીઓ તમિલ વારસો અને સંસ્કૃતિ વિશે વધુ જાણવા, ચીની નૂતન વર્ષ ઉજવવા, અને આ રોમાંચક આગામી આયોજનોમાં આપણાં અશ્વેત આફ્રિકી અને કેરિબીયન સમુદાયોના ફાળાને ઓળખ આપવા અમારી સાથે જોડાશે.”

- મેયર પેટ્રિક બ્રાઉન (Patrick Brown)

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તમાં 70,000 વ્યાપારો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતા પ્રવાસનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](https://twitter.com/brampton), [Facebook](https://facebook.com/brampton), અને [Instagram](https://instagram.com/brampton) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

### મિડિયા સંપર્ક:

મોનિકા દુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)